


શિયાળુ જુવારમાં આવતા રોગો - જુવાતો અને તેનું નિયંત્રણ



:: લેખક ::

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર
નવસારી કૃષિ યુનિવર્સિટી
દેડીયાપાડા - ૩૬૩ ૦૪૦, ગુ. નર્મદા

દક્ષિણ ગુજરાતમાં દાઢા તરીકે, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં દાઢા અને ચારા તેમજ એકલા ચારા માટે જ્યારે ડેરી વિકસિત વિસ્તારમાં એકલા લીલાચારા તરીકે કુલ ૭.૪૫ લાખ ડેક્રટરમાં જુવારનું વાવેતર થાય છે. ચોમાસુ અને શિયાળુ અનુભૂતિમાં જુવારની ઉત્પાદકતા અનુકૂળે ૭૩૭ અને ૮૮૦ કિ.ગ્રા./હે.એ છે. ચોમાસુ અનુભૂતિમાં ચારા તરીકે જુવારનું વાવેતર થઈ હોવાથી તેની ઉત્પાદકતા શિયાળુ અનુભૂતિ સરખામણી ઓછી થવા પામી છે. પરંતુ જો ફક્ત દાઢા તરીકે વાવેતર કરતા વિસ્તારને લખસામાં રખાતાં તેની ઉત્પાદકતામાં આશરે ૧૦૦૦ કિલો વધારો દેખાયો છે. ગુજરાતમાં મુખ્યત્વે ઉનાળુ (માર્યથી જુના પ્રથમ પખવાડિયા સુધી), ચોમાસુ (જુના બીજા પખવાડિયથી સપ્ટેમ્બર સુધી) અને શિયાળુ (ઓક્ટોબરથી ફેલ્ઝુઆરી) એમ ત્રણ અનુભૂતિમાં વાવણી છે. દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે જુવાર દાઢા માટે વવાય છે. જેમાં ખેડૂતો સ્થાનિક જાતો જે મોડા વાવેતર માટે અનુષુણ છે. તેવી બીજી પદ, સુરત ૧ અને જીજે ૧૦૮ અપનાવે છે. આ જાતોની ઉત્પાદકતા ખૂબ ઓછી તેમજ દાઢા હુંગગાણ્ય છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પુરતા પ્રમાણમાં હોય છે. આ સ્થાનિક જાતો વાવેતર હેઠળ હોવાથી બીજા પાકોની સરખામણીમાં જુવાર જેવો પાક વધુ નફાકારક થઈ શક્યો નથી. આથી વધુ ઉત્પાદકતા ઓછા જ ખર્ચે મેળવી શકાય. દાઢાની ગુણવત્તા નવી વિકસાવેલ જાતો જેવી ગુજરાત જુવાર ત૮, જીજે ૪૦ની દેશો જાતો જેવી છે. ખેડૂતોએ ગુજરાત જુવાર ત૮, જીજે ૪૦, જીજે ૪૧ અને જીએસએચ ૧ તેમજ તેને અનુરૂપ વિકસાવેલ આનુષુણ ભેટી પથ્થતિઓ વધુ ઉત્પાદન મેળવવા માટે અપનાવવી જોઈએ. ઘસચારાના પાકોમાં જુવાર પાક વધુ પ્રચલિત છે. કારણકે તેમાં અન્ય પાકોની સરખામણીમાં પોષકતત્વો વધુ હોવાથી પશુઓ લીલાચારા, સુકાચારા કે અથાદા (સાઈલેજ) તરીકે તેને વધુ પસંદ કરે છે. આ પાક પાણીની અધ્યત સામે ટક્કર જીવી શકે છે. તેમજ વધુ વરસાદ સામે પણ ટી શકે છે. વધુમાં શારવાળી જમીનમાં પણ થઈ શકે છે. જુવાર પાકને ફક્ત ઘસચારા (બાટુ) તરીકે ઉગાડવામાં આવે તો તેમાં દાઢા લીધા બાદ રાખેલ ઘાસ (કડબ) કરતાં વધુ પોષક તત્ત્વો રહેલાં હોય છે. લીલોચારો પશુને ખવાડવાળમાં આવે તો તેમાંની કેરોટીન અને પ્રજીવકો જેવા તત્ત્વો પણ વધારાના મળી શકે છે. જુવારનો ઘસચારો ડીચી ગુણવત્તા ધરાવે છે. જેથી પાક સુધારણા કામગીરી સધન બનાવતા હાલમાં સુધારેલી જાતો જીએકેએસ ૩, જીએકેએસ ૪, જીએકેએસ ૫ વિકસાવીને વાવેતર માટે ભલામણ કરવામાં આવી છે. ઘસચારાની જુવારની જાતો મીઠી અને રસદાર સાંદાળાણી કે વધુમાં ફુલ દ્રાવ્યક્ષારો ધરાવતી ઘાસના ઉત્પાદન માટે ડીચી અને નાજુક જાનવરોને ભાવે તેમજ સરળતાથી પચી શકે તેવી, વધુમાં વધુ પીલા ફુટી શકવાની ક્ષમતા ધરાવતી અને એક કરતાં વધુ વાઢ ટુંક સમયમાં આપી શકે તેવી રોગ અને જીવાતો સામે પ્રતીકારકતા, મધ્યમ મોડી પાકતી, વધુમાં વધુ બિયારણ પેદા કરી શકાય તેવીક, હાઈડ્રોસાઈનીક એસેડ અને પુરિક એસેડ ઓછી ધરાવતી અને નાઈટ્રોટ એર નહીંવત હોવું જોઈએ.

જીવાત નિયંત્રણ :

(અ) વેદળો:

જુવારના પાકને નુકશાન કરતાને વેદળોમાં સાંદાની માખી, સાંદાનો વેદળ અને સાંદાનો ગુલાબી વેદળ મુખ્ય છે.

૧) સાંદાની માખી (શૂર ફલાય): એથેરોગોના સોકાટા

ઓળખ: ઈડા સંક્રિય રંગના, નાળાકાર અને પાનારી સપાતીની નજીક ચ્યપટા હોય છે. જ્યારે પુખ માખી સંક્રિય અને આશા રાખોડી રંગની હોય છે.



જુકશાન: ઈડામાંથી નીકળેલો ક્રોડો સાંદામાં કોરાણ કરી વિકસાસ પામતા પીલાને કાપી ખાય છે. પરિણામે મધ્ય પીલો સુકાયને મરી જાય છે. જેને “ડેડ હાર્ટ” કહે છે. નુકશાન પામેલા છોડનાં સાંદાની બાજુએ ફૂટ કે પીલા જોવા મળે છે.


નિયંત્રણ વ્યવસ્થાઓ:

- > પ્રતીકારક જાતો જેવીકે કોડ ૧, સીએસએસ ૧૫ આર, મલદાની અને હગારીનું વાવેતર કરવું.
- > જુવારની વહેલી વાવણી આ જીવાતનો ઉપક્રમ ઘટાડી શકાય છે.
- > જુવારના બીજાને કલોરાપાયરીફોસ ૨૦ ના દ્રાવકણમાં ૮ કલાક બોળી રાખી વાવેતર કરવું
- > ઓગાષ પદ્ધતીની વાવણીમાં ઉપક્રમ વધુ જોવા મળતો હોવાથી જુવારના બીજાને દિયેલનો પટ આયા બાદ થાયમિથોક્ઝામ ૭૦ ટકા ત ગ્રામઅથવા કાર્બોસલ્ફન ૨૫ એસેટી દવા ૧૬૦ ગ્રામ અથવા ઈમિડાકલોપ્રોડ ૭૦ ઇભલ્યુ. એસ ૧૦ ગ્રામપ્રતિ કિલો બીજ મુજબ બીજ માવજાતાની તરત જ વાવણી નુકશાન ઘટાડી શકાય છે.
- > જુવારની સીથી વાવણીમાં બીજ દર વધુ (૧૨.૫ કિ.ગ્રા.ફે.) રાખવાથી નુકશાન ઘટાડી શકાય છે.
- > જુના પાકની કાપવી બાદ તરત જ ખેડે કરી જુના પાક અવરોધોનો નાશ કરો.
- > જરૂર જણાયે રાસાયણિક જંતુનાશકોનો ભલામણ મુજબ ઉપયોગ કરવો જેમકે સાયપરમેથીન ૧૦ ઈસી ૧૦ લીટર પાવણીમાં ૫ મી.લી. ઓગાળીને છંટકાવ કરવાથી આ જીવાતનું નિયંત્રણ થાય છે.
- > બીજ ઉત્પાદન પ્લાટમાં કાર્બોફ્યુરાન ૩% દાઢાદાર દવા ર ગ્રામપ્રતિ એક મીટર ચાસમાં વાવણી વખતે આપવી.

૨) સાંદાનો વેદળ (સ્ટેમબોર): ક્રોડો પાટેલસ અને

૩) સાંદાનો ગુલાબી વેદળ (પીક સ્ટેમબોર): સીમીયા ઇન્ડેન્સ

ઓળખ: સાંદાનો વેદળના ઈડા દેખાવે ભૌગોળાણી જીવાત જેવા ચયપટા, લંબગોળ અને જથ્થામા પાનાની નીચેની સપાતીએ મુખ્ય નસની નજીક જોવા મળે છે. ઈડા પીળાશ પડતા કથ્થઈ રંગની અને વેરા કથ્થઈ રંગના માથાવણી હોય છે. જ્યારે કૂદુ મધ્યમકદનું અને પરાળ જેવા રંગનું હોય છે.



(ભ) કષાસલાની જીવાતો:

કષાસલાને તુકશાન કરતી જીવાતોમાં લીલી ઈયળ, દાણાની મીજ અને કષાસલાના ચૂસિયાનો સમાવેશ થાય છે. આ ઈયળો મોટે ભાગો સંકર જાતોમાં જોવા મળે છે.

૧) કષાસલાકોરી ખાનાર ઈયળ (ઇયર હેડ કેટરપીલર): હેલીકોવર્પા આર્મીજેરા

ઓળખ: ઈડા આધા પીળા રંગના, ગોળ અને છુટા છવાયા હોય છે. ઈયળ લીલાશ પડતા રંગની કે કથ્થઈ રંગની અને ઘેરા કથ્થઈ રંગની સમાંતર લાઈન સાથે સફેદ લાઈન વાળી હોય છે. જયારે પુખ્ન ફૂદું આધા પીળા કે કથ્થઈ રંગનું, મધ્યમ કદનું અને લીલાશ કે આધા કથ્થઈ રંગની ગોળ ટપકા વાળી અથ્વ પાંખ તેમજ આધા ખુમાડીયા સફેદ રંગની, મોટા કાળા ખૂણાવાળી પશ્વ પાંખ ધરાવે છે.

નુકશાન: ઈડામાંથી નીકળેલી ઈયળ કષાસલામાં વિકસતા દૂધિયા દાણ ખાય છે. તુકશાન પામેલ કષાસલું સફેદ રંગનું અને અર્ધ ખાવેલું દેખાય છે. કષાસલામાં હગાર જોવા મળે છે.



નિયંત્રણ વ્યવસ્થાપન:

- > ઉનાળામાં ઈડી બેદ કરવી
- > ખેતરના શેઢા-પાળા ચોખ્યાં રાખવા
- > પાકની કષાસલા અવસ્થાએ રાતિના સમયે રથી ઉ પ્રકાશ પિંજર/હે. ગોઠવવા
- > લીલી ઈયળ માટેના ફેરોમોન ટ્રેપ પ/હે. લગાડવા
- > પેટરમાં પશીઓને બેસવા માટે લાકડાના ટેકા ૧૦ થી ૧૨ લગાડો
- > લીલી ઈયળના નિયંત્રણ માટે ભલામજા મુજબ અને. પી.વીનો (CX ૧૦^૦ પો.ઓ.બી) નો ઉપયોગ કરો
- > બી.ટી.પાવડર ૫૦૦ ગ્રામ/હેક્ટર મુજબ ઉપયોગ કરો
- > કષાસલું ઉણ્યા બાદ ઉજા અને ૧૮ મા દિવસે કાર્બારીલ ૧૦% અથવા મેલાથીઓન ૫% અથવા ફોઝેલોન ૪% ભૂકીનો રપક્ષિ. ગ્રા. પ્રતિ હેક્ટરો છંટકાવ કરવો.

૨) દાણાની મીજ (સોરગામિજ): કોન્ટારીનીયા સોરગીકોલા

ઓળખ: પુખ્ન માખી નાના કદની, કોમળા, ચણકતા કેસરી રંગનું ઉદર અને પારદર્શક પાંખો ધરાવે છે.

નુકશાન: ઈડામાંથી નીકળેલી ઈયળ કષાસલામાં વિકસતા દૂધિયા દાણ ખાય છે. તુકશાન પામેલ કષાસલું સફેદ રંગનું અને અર્ધ ખાવેલું દેખાય છે. કષાસલામાં હગાર જોવા મળે છે.



નિયંત્રણ વ્યવસ્થાપન:

- > ઉપદ્રવિત પીલાને તથા સુકાઈ ગયેલા કષાસલાવાળા છોડને બાળી નાંખવા અથવા ઈડા ખાડામાં દાટી દેવા.
- > ઉનાળામાં જાયાં ચારા માટે જુવાર ઉગાડવામાં આવે તથા કષાસલા કાપીને છોરને ખવડાવી દેવા.
- > એક જ વાવેતર વિસ્તારમાં એક સાથે એક જ જાતની વાવણી કરવી જોઈએ અને વહેલી વાવણી કરવાથી પણ આ જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.
- > શિયાળું પાક માટે સાટેમ્બરના પદેલાં પખવાડીયામાં વાવણી કરવી.
- > કષાસલામાં ૫૦% ફૂલ આવી જાય તથા પ્રોફેનોફેસ ૪૦ ઈસી રૂપ મીલી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી કષાસલા ઉપર છાંટવી. અને ફરી થી ૧૦ દિવસે બીજો છંટકાવ કરવો. અથવા
- > જો ઉપર જણાવેલ દવાનો છંટકાવ શક્ય ન હોય તો અન્ડોસલ્ફાન ૪% અથવા કાર્બારીલ ૫% અથવા મેલાથીયોન ૫% ભૂકી ૨૦ થી ૨૫ કિલો પ્રતિ હેક્ટર મુજબ કષાસલા ઉપર છાંટવી.

૩) કષાસલાના ચૂસીયા : (ઇયર હેડ બગ): કલોકોરોસ એન્ગ્નુસ્ટેટસ

તે કષાસલામાં દાણ દૂધ અવસ્થાએ હોય ત્યારે દાણાની રીતે ચૂસીને તુકશાન કરે છે જેથી દાણા પોપાતા નથી અને ચીમણાયેલા લાલાશ પડતા રંગના થઈ જાય છે. જેથી દાણાના ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે.



નિયંત્રણ :

- > પ્રોફેનોફેસ ૪૦ ઈસી રૂપ મીલી દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળી કષાસલા ઉપર છાંટવું. અથવા મેલાથીયોન ૫ ટકા ભૂકી હેક્ટરે ૨૫ થી ૩૦ કિ.ગ્રા. મુજબ છંટકાવ કરવો.

(ક) રસ ચૂસીટી જીવાતો:

૧) મોલો - મશી : પેરોગ્રિન્સ મેડીસ અને રેફ્લોસિક્સિક્મેડીસ

પાકની શરૂઆતની વધ અવસ્થાએ લીલા રંગની અને તે પુરી થયા બાદ અને કષાસલા નિકળે તે પહેલાં કાળી, અને કષાસલા અવસ્થાએ પાનની નીચે અને કષાસલામાં પીળા રંગની મોલોમશી જોવા મળે છે. મોલોમશીના બચ્ચા તથા પુખ્ન ક્રીટક પાનની બુંગળી તથા પાનમાંની રસ ચુસે છે. તેથી પાન પીળા પરી જાય છે. આ



જીવાતના શરીમાંથી ચીકણા મધ્ય જેવો પદાર્થ જરતો હોવાથી પાન ઉપર કાળી ફુગનો વિકાસ થાય છે. પરીક્ષામે પ્રકાશ સંશ્લેષણની કિયા અવરોધાવાથી છોડની વૃદ્ધિ અટકી જાય છે.

નિયંત્રણ : આ જીવાત ઉપર નહતા પરભક્તી ડાળીયા (લેરી બીટલ) મોટી સંખ્યામાં જોવા મળે છે. જેથી જંતુનાશક દવા છાંટવાની જરૂરિયાત રહેતી નથી. તેમ છતાં જરૂર જરૂરાય તો ડાયમિથીએટ ત૦ ઈસી ૧૦ મીલી અથવા મિથાઈલ-ઓ-ટેમેટોન ૨૫ ઈસી ૧૦ મીલી દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવાથી નિયંત્રણ થઈ શકે છે.

૨) પાન કથીરી : ઓળોગોનોકસ ઇન્ફિક્શન

આ કથીરી લીલાશ પડતાં ભૂખરા તેમજ શરીર ઉપર કાળાશ પડતા રંગના ધાબા અને ચાર ઝોડી પગ હોય છે. બ ચ્યાં અને પુષ્ટ પાનની નીચેની સપાઈએ જાળામાં સમૂહમાં રહી રસ ચૂસે છે. આથી પાન પર પીળાશ પડતા અસંખ્ય ડાધા જોવા મળે છે. આ ડાધા એકલીજા સાથે જોડતા પીળા કે લાલાશ પડતા મોટા ધાબા બને છે. પરીક્ષામે છોડની વૃદ્ધિ અટકે છે. આ કથીરીનો ઉપદ્રવ ઓગષ્ટ થી રીસેમ્બર માસ દરમયાન વધુ પ્રમાણમાં જોવા મળે છે. સામાન્ય રીતે દેશી જાતોમાં ૬૦ થી ૭૦ ટિવસે અને સંકર જાતોમાં ૫૦ થી ૬૦ ટિવસે ધાબા જોવા મળે છે.



નિયંત્રણ :

- ડાયકોફોલ ૧૮.૫ ઈસી, ઈથીઓન ૫૦ ઈસી, કથીરી નાશક દવા ૧૦ લીટર પાણીમાં ૨૫ મીલી અથવા મીથાઈલ-ઓ-ટેમેટોન ૨૫ ઈસી અથવા ડાયમી થોએટ ૩૦ ઈસી દવા ૧૦ લીટર પાણીમાં ૧૦ મીલી મુજબ ભેણવી છાંટવાથી નિયંત્રણ થઈ શકે છે.
- વેટેબલ સલ્ફર (૨૫ ગ્રામ/૧૦ લીટર પાણીમાં)નો છંટકાવ કરવાથી પાનકથીરીનું નિયંત્રણ થઈ શકે છે.

(૪) અન્ય જીવાતો:

૧) કાતરા (નિહાર હેરી કેટર પીલર): ઓમસેકટા મુરી

આ જીવાતનો ઉપદ્રવ ચોમાસામાં પ્રથમવરસાદ થયા બાદ જોવા મળે છે. માદા કિટક નિંદામણ અને ઘાસ ઉપર ઈડા મુકે છે.

નિયંત્રણ :

- અસરકારક નિયંત્રણ માટે પ્રથમવરસાદ પછી ત્રીજા ટિવસે કિવનાલફોસ ૧.૫ ટકા ભુકીનો શેદાપાળા ઉપર છંટકાવ કરવો.
- ઉભા પાકમાં ઉપદ્રવ જોવા મળે તો ઈયણો જયારે નાની હોય તથારે કિવનાલફોસ ૧.૫ ટકા અથવા મિથાઈલ પેરાથિયોન ૨ ટકા ભુકીનો હેક્ટરે ૩૦ કિ.ગ્ર. પાઉડરનો છંટકાવ કરવો.
- દિવેલાની ડોડવા કોરી ખાનાર ઈયણ, દાઢા કોરી ખાનાર ગુલાબી ઈયણ અને જાળા બનાવનારી ઈયણનો સમાવેશ થાય છે. કષસલાંના જયારે પરાગનયન થયા બાદ આશરે ૧૫ ટિવસ સુધી દાઢા ખાઈને ૨૦-૨૫ ટકા જેટલું નુકશાન કરે છે. આ ઈયણો મોટે ભાગો પોક અવસ્થા પછી નુકશાન કરતી નથી.

રોગ નિયંત્રણ :

૧. જૂવારનો મધિયો :

જૂવારના મધિયાથી બયવા માટે જૂવારનું વાવેતર જૂલાઈ માસના બીજા પખવાડિયા દરમયાન કરવું હિતાવહ છે. જેથી દાઢા તેમજ ચારાનું વધુ ઉત્પાદન મળે છે. જાયરમ૦.૨ ટકાના બે છંટકાવ જેમાં પ્રથમ છંટકાવ કુલ અવસ્થા પહેલાં અને બીજો છંટકાવ પ્રોફેક્ટિવ ૫૦% કુલ અવસ્થા દરમયાન કરવાથી મધિયાના રોગને કાબુમાં લઈ શકાય છે.

૨. દાઢાની કુગો :

દાઢાની કુગોની અસરકારક નિયંત્રણ માટે મેનકોલેબ ૦.૨ અને કેપ્ટાન ૦.૨ અથવા થાયરમ ૦.૨ અને કાર્બોનિઝમ ૦.૦૫ ટકા મિશ્રણના બે છંટકાવ, પ્રથમ કુલ અવસ્થાની શરૂઆત થયે અને બીજો છંટકાવ પ્રથમ છંટકાવના ૧૦ ટિવસ બાદ કરવો જરૂરી છે.

૩. પ્રકાંડનો કાજલ સડો :

વાવણી સમયે કુગોનાશક દવા ટીઓમટીડી ૪.૫ કિ.ગ્ર./લે. પ્રમાણે ચાસમાં આપવાથી આ રોગનું પ્રમાણ નહીંવત જોવા મળે છે. તેમજ દાઢા તથા ચારાનું વધુ ઉત્પાદન મળે છે.

વધુ ઉત્પાદન મેળવવાની ચાચીઓ :

- ગુજરાત રાજ્યના વિવિધ જોન માટે ભલામણ કરેલી જૂવારની સુધારેલ/સંકર જાતોની સમયસર વાવણી કરવી તથા ભલામણ કરેલ રાસાયણિક ખાતર આપવું.
- વધુ વરસાદવાળા વિસ્તારમાં કરેરોપણીનો આગ્રહ રાખી ૨૪ ટિવસના ધર્તનો ઉપયોગ કરવો.
- જૂવારના પાક સાથે આંતરપાક તરીકે તુવેરનો ઉપયોગ કરવો.
- પાકની કટોકાંની અવસ્થાઓ જેવી કે ગાંધ બાંધવાના સમયે, કુલઅવસ્થા અને દાઢા દૂધે ભરાવવાના સમયે ભેજની ખેંચ જણાય તો પિયત આપવું. ચોમાસુ ઋતુમાં પાણીનો ભરાવો અટકાવવો.
- ખેતર નિંદામણથસ મુકન રાખવું. જરૂર પડે પાક સંરક્ષણના પગલાં લેવા.
- પાકની કાપણી સમયસર કરવી. લીલા ચારા માટે કુલ અવસ્થા બાદ તુરત જ કાપણી કરવી.